

૪૮. શ્રી અમિતગતિ સામાચિક પાઠ

પદ્યાનુવાદ

(હરિગીત છંદ)

સૌ પ્રાણી આ સંસારનાં સનિમિત્ર મુજ વાલાં થળો,
સદગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હળો;
દુઃખીએ પ્રતિ કસણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા,
શુભ ભાવનાં પ્રભુ ચાર આ; પામો હદ્યમાં સ્થિરતા. ૧

અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે,
એ ભ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે;
હું શરીરથી જુદો ગાણું એ, જ્ઞાનબળ મુજને મળો,
ને ભીષણ જે અજ્ઞાન મારું, નાથ ! તે સત્ત્વર ટળો. ૨

સુખદુઃખમાં અરિમિત્રમાં સંયોગ કે વિયોગમાં,
રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં;
મમ સર્વકાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી,
તું આપણે મુજ મોહ કાપી, આ દશા કસણાનિધિ. ૩

તુજ ચરણ કમળનો દીવડે, ઝો હદ્યમાં રાખજો,
અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો;
તદ્રૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો,
તુજ ચરણયુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત્ય ઝૂબતો. ૪

પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહીં તહીં
એકેન્દ્રિયાદિ જીવને હણતાં કદી ઉરતો નહીં;

છેદી વિલેદી દુઃખ દઈ, મેં ગ્રાસ આપ્યો તેમને,
કરળો ક્રમા મુજ કર્મ હિંસક, નાથ વીનવું આપને. ૫

ક્ષાયને પરવશ થઈ બહુ, વિષયસુખ મેં ભોગવાં
ચારિત્રના જે ભંગ વિલુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા;
કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્, આચરણ મેં આદર્દુ,
કરળો ક્રમા સૌ પાપ તે, મુજ રંકનું જે થયું. ૬

મન વચન કાયા ક્ષાયથી, ક્રીધાં પ્રલુ મેં પાપ બહુ,
સંસારનાં દુઃખબીજ સૌ, વાવાં અરે હું શું કહું ?
તે પાપને આલોચના, નિંદા અને ધિક્કારથી,
હું ભર્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. ૭

મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી,
બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવા પ્રલુ કુબુદ્ધિથી;
કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી,
સૌ દોષ મુક્તિ પામવા, માગું ક્રમા હું હદ્યથી. ૮

મુજ મહિન મન જો થાય તો, તે દોષ અતિક્રમ જાણતો,
વળી સદાચારે ભંગ બનતાં, દોષ વિત્કિમ માનતો;
તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં મહાલતો,
અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. ૯

મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો,
જો અર્થ માત્રા પદ મહી, લવલેશ વધદટ હોય તો;
યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રલુ હું આપનો,
આપી ક્રમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. ૧૦

પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો,
વળી ઈષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણિ હું ધારતો;
સુબોધ ને પરિણામશુદ્ધ સંયમને વરસાવતી,
તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોક્ષ લક્ષ્મી અર્પતી. ૧૧

સ્મરણ કરે યોગી જનો, જેનું ધારું સન્માનથી,
વળી ઈન્દ્ર નર ને દેવ પણ, સુતિ કરે જેની અતિ;
એ વેદ ને પુરાગ જેનાં, ગત્ય ગીતો હર્ષમાં,
તે દેવના પણ દેવ વ્હાલાદ, સિદ્ધ વસળો હદ્યમાં. ૧૨

જેનું સ્વંત્રપ સમજાય છે, સદ્જાન દર્શન યોગથી,
ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી;
પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં,
તે દેવના પણ દેવ વ્હાલાદ, સિદ્ધ વસળો હદ્યમાં. ૧૩

જે કઠિન કાટો કાપતા જ્ઞાણવારમાં સંસારનાં,
નિહાળતા જે સૃષ્ટિને જેમ બોરને નિજ હસ્તમાં;
યોગી જનોને ભાસતા જે, સમજતા સૌ વાતમાં,
તે દેવના પણ દેવ, વ્હાલાદ, સિદ્ધ વસળો હદ્યમાં. ૧૪

જન્મ મરણનાં દુઃખને, નહિ જાગતા કદી જે પ્રભુ,
જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિલ્લુ;
કલંકહીન દિવ્યત્રપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં,
તે દેવના પણ દેવ, વ્હાલાદ, સિદ્ધ વસળો હદ્યમાં. ૧૫

આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૂહ રાખતા,
નહિ રાગ કે નહિ દ્રોષ જેને, અસંગ ભાવે વર્તતા;
વિશુદ્ધ ઈન્દ્રિય શૂન્ય જેવાદ, જ્ઞાનમય છે રૂપમાં;
તે દેવના પણ દેવ વ્હાલાદ, સિદ્ધ વસળો હદ્યમાં. ૧૬

ત्रिलोकमાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે,
નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે;
વિકાર સૌ સળગી જતાં મન મસ્ત થાતાં ધ્યાનમાં,
તે દેવના પણ દેવ વ્યાલાદ સિદ્ધ વસજો હદ્યમાં. ૧૭

સ્પર્શ તલભાર તિમિર કેરો, થાય નહિ જ્યમ સૂર્યને,
ત્યમ દુષ્કલંકો કર્મનાં, અડકી શકે નહિ આપને;
જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધી વિરાજતો,
તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૧૮

રવિ તેજ વિશુ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો,
તે જ્ઞાનદીપ પ્રકાશ તારાં આત્મમાં શું દીપતો;
જે દેવ મંગળ બોધ મીઠા, મનુજને નિત્ય આપતો,
તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૧૯

જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે,
જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે;
અનંત અનાદિ દેવ જે, અજ્ઞાન તિમિર ટાળતો,
તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૦

જેણે હાયા નિજ બળવડે, મન્મથ અને વળી માનને,
જેણે હાયા આ લોકના, ભય શોક ચિંતા મોહને,
વિષાદ ને નિદ્રા હાયાં જ્યમ અનિન વૃક્ષો બાળતો,
તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૧

હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાઢનું,
મુજ આત્માના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું;
આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વીણ જો,
આગમૂલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તો. ૨૨

મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની,
જગબાહયની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની;
સંસારની સૌ વાસનાને, છોડ વાલા વેગથી,
અધ્યાત્મમાં આનંદ લેવા, યોગ બળ લે હોંશથી. ૨૩

આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી,
વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં;
આ તત્ત્વને સમજુ ભલા, તું મોહ ધરનો છોડજે,
શુભ મોક્ષનાં ફુળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪

જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે,
શુભ યોગમાં સાધુ સકળને, આત્મ અનુભવ થાય છે;
નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં.
સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં. ૨૫

આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે,
વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે;
વિશ્વની સહુ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે,
નિજકર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨૬

જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની,
તો એકતા શું આવશે, સત્ત્વી પુત્ર મિત્રો સાથની ?
જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં,
તો રોમ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા ? ૨૭

આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહબંધન થાય છે,
તો જન્મ મૃત્યુ ચકમાં ચેતન વધુ ભટકાય છે;
મુજ મન, વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો,
શુભ મોક્ષની અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. ૨૮

સંસારદ્વારી સાગરે, જે અવનતિમાં લઈ જતી;
તે વાસનાની જાળ આરા, તોડ સંયમ જોરથી;
વળી બાહ્યથી આત્મ છે જુદો, ભેદ મોટો જાણવો,
તલ્લીન થઈ જગવાનમાં, ભવપંથ વિકટ કાપવો.

૨૯

કર્મો કર્યો જે આપણે, ભૂતકાળમાં જન્મો લઈ,
તે કર્મનું ઇણ ભોગવ્યા વિણુ, માર્ગ એકે છે નહીં;
પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને,
તો મુજ કરેલાં કર્મનો, સમજાય નહિ કંઈ અર્થને.

૩૦

સંસારનાં સૌ પ્રાણીઓ, ઇણ ભોગવે નિજ કર્મનું,
નિજ કર્મના પરિપાકનો, ભોક્તા નહિ કો આપણું;
લઈ શકે છે અન્ય તેને, છોડ એ જ્ઞમણા બુરી,
પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્મનો આશ્રય કરી.

૩૧

શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના,
આ દાસ તારો હદ્યથી, ગુણ ગાય તુજ સામર્થ્યના;
પ્રગટના જો ગુણ બધા, મુજ આત્મમાં સહભાવથી,
શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી ?

૩૨

(દોહરો)

બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય;
અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીવ જાય.

